



પ્રેઝન્ટર

હેલો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Phil

Hi, I'm Phil. Welcome to the programme.

Sam

And I'm Sam. Hello everyone!

Phil

Guys, I really need to share this story with you! Did you hear about the 99-year-old swimmer who broke the world record in Australia?

પ્રેઝન્ટર

Wait, wait! Before we listen to the story, as you brought up the topic of an athletics competition, Phil, let me ask you a quick question about the world's oldest and biggest athletics competition – the Olympic Games.

મિત્રો, પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સની પ્રથમ હસ્તલિખિત લિપી 776 ઈસવીસન પૂર્વેની છે. તે સમય માત્ર એક જ સ્પર્ધા થતી હતી. તો મિત્રો, આજનો પ્રશ્ન છે કે એ સ્પર્ધા કઈ હતી? તમારા ઓપ્શનસ્ છે:

અ) તરવું

બ) કુસ્તી

ક) ટ્રેક અને ફિલ્ડ

Sam

Mmh, that's a good question!

Phil

Let's talk about it later! I really want you to hear this story!

પ્રેઝન્ટર

Phil, you're very excited about this, aren't you? તો મિત્રો, હવે તમે BBC World Service દ્વારા કરવામાં આવેલી ન્યૂઝ સાંભળો જેમાં 99 વર્ષનાં વૃદ્ધ વિશે વાત કરવામાં આવી છે. 99 વર્ષની ઉંમર હોવા છતાં જ્યોર્જ કોરોન્સ તરવામાં નવો વિશ્વવિક્રમ પોતાના નામે અંકિત કર્યો છે.

News Insert

While most around him were sweating over claiming a place in the Commonwealth Games, George Corones used the Australian trials as a way to put his name in the record books. The only entry in the 100-104 age group, he swam alone covering 50 metres in 56.12 seconds. Corones says he only started taking swimming seriously at the age of 80 and while this won't win him a place in the games, he does have his sights set on another record. Tomorrow night, he returns to swim in the 100 metre freestyle.

Phil

Isn't that amazing?

Sam

But was he competing in the games? I didn't quite understand.

પ્રેઝન્ટર

No, he was just using the trials as a way to put his name in the record books. ગુજરાતીમાં 'trail' નો અર્થ થાય છે કસોટી. બીજો અર્થ થાય છે પરીક્ષા.

Phil

Yeah, they said that while he didn't win a place in the games, he did win a place in the record books.

Sam

I hear a story like that, and I just feel a little inadequate, to be honest.

પ્રેઝન્ટર

'To feel inadequate' એટલે અપૂરતું લાગવું. મિત્રો, 'inadequate' એ adequate નો વિરોધી શબ્દ છે.

'Adequate' નો ગુજરાતીમાં અર્થ થાય છે પૂરતું. That's not good, Sam!

Phil

Oh, no, Sam, a story like this shouldn't make you feel inadequate. It just proves that age shouldn't be a barrier to achieving your dreams. It should be motivating!

પ્રેઝન્ટર

'To be motivating' એટલે પ્રોત્સાહિત કરવું. I agree, age shouldn't be a barrier here. 'Barrier' ને ગુજરાતીમાં કહીશું અવરોધ. બીજો અર્થ થાય છે અંતરાય.

Sam

I guess what's motivating for some people, is demoralising for others.

પ્રેઝન્ટર

'To be demoralising' એટલે નૈતિક બળ તોડી નાંખતું. Do you really find this story demoralising, Sam?

Phil

Trust you to hear a story as positive as this one and think it's demoralising, Sam!

Sam

Don't get me wrong, I also think it's very impressive.

પ્રેઝન્ટર

Oh, good! 'To be impressive' નો ગુજરાતીમાં અર્થ થાય છે પ્રભાવશાળી લાગવું. તમે અંગ્રેજીમાં કહી શકો છો 'to be impressed by something or someone' એટલે કે કોઈ વ્યક્તિ અથવા બાબતથી પ્રભાવિત થવું. I'm impressed by this man, definitely!

Phil

Yeah, me too! I'm so impressed by his thirst for life.

પ્રેઝન્ટર

Thirst for life' એટલે જીવન જીવવાની જિજીવિષા.

Sam

Yeah, absolutely. I'm just saying that his impressive thirst for life can also be demoralising!

પ્રેઝન્ટર

Ok, Sam, let's see if you find *this* motivating! Do you remember the question I asked you earlier? પ્રશ્ન હતો કે પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સની પ્રથમ હસ્તલિખિત લિપીમાં નોંધાયેલ સ્પર્ધા કઈ હતી?

અ) તરવું

બ) કુસ્તી

ક) ટ્રેક અને ફિલ્ડ

What do you think the answer is, Sam?

Sam

I think it was c.

પ્રેઝન્ટર

And you're correct. The answer is c. track and field.

Phil

That was very impressive, Sam!

Sam

Yeah, yeah. I know what you two are trying to do, and it won't work.

પ્રેઝન્ટર

Ha ha! Not sure Sam is very impressed by us, Phil! આજે 'achievement' એટલે કે સિદ્ધિ સાથે સંલગ્ન જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ.

'To feel inadequate' એટલે અપૂરતું લાગવું જ્યારે 'to be motivating' નો અર્થ થાય છે પ્રોત્સાહિત કરવું. 'To be demoralising' ને ગુજરાતીમાં કહીશું નૈતિક બળ તોડી નાંખતું અને 'to be impressive' એટલે પ્રભાવશાળી લાગવું.

આવા જ બીજા રસપ્રદ ટોપિક સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી Bye!